

-: અખબારી યાદી:-

## “વન વીક, વન રોડ” ઝુંબેશ

ઈસ્ટ ઝોનમાં પેડક રોડ ખાતે વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ:

તારીખ: ૧૫-૦૧-૨૦૨૨

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા. ૧૫-૦૧-૨૦૨૨ના રોજ ઈસ્ટ ઝોનમાં પેડક રોડ ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે.

### (ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી)

વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.૫ તથા ૬માં સમાવિષ્ટ પેડક રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતેના દબાણો / ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૨૮ સ્થળોએ થયેલ છાપરાનું દબાણ દુર કરી અંદાજે ૯૧૦.૦૦ચો. ફૂટ પાર્કિંગ/માર્જીનની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે.

ક્રમ	સ્થળ	દુર કરાવેલદબાણની વિગત
૧	અમિતકુટવેર	છાપરાનું બાંધકામ
૨	વત્સલ સેલ્યુલર	છાપરાનું બાંધકામ
૩	ગુડલક ઈલેક્ટ્રીક	છાપરાનું બાંધકામ

ક્રમ	સ્થળ	દુર કરાવેલદબાણની વિગત
૪	પૂજન મેડિકલ સ્ટોર	છાપરાનું બાંધકામ
૫	પંડિત દીનદયાળ ગ્રાહકભંડાર	છાપરાનું બાંધકામ
૬	પટેલ સોપારી સેન્ટર	છાપરાનું બાંધકામ
૭	શ્રીજી ગાઠીયા	છાપરાનું બાંધકામ
૮	કુમકુમ ગીફ્ટ શોપ	છાપરાનું બાંધકામ
૯	શિવ શક્તિ ટી સ્ટોલ	છાપરાનું બાંધકામ
૧૦	બજરંગ પ્રોવિઝન સ્ટોર	છાપરાનું બાંધકામ
૧૧	પટેલ ખમણ	છાપરાનું બાંધકામ
૧૨	પટેલ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર	છાપરાનું બાંધકામ
૧૩	ભોજલ ક્લિનીક	છાપરાનું બાંધકામ
૧૪	અમુલ સેલ્સ એજન્સી	છાપરાનું બાંધકામ
૧૫	કનૈયા ટી સ્ટોલ ડીલાઈટ પાન-	છાપરાનું બાંધકામ
૧૬	ગાત્રાળ ટી સ્ટોલ	છાપરાનું બાંધકામ
૧૭	શક્તિ ટી સ્ટોલ	છાપરાનું બાંધકામ
૧૮	માં સિઘોઈ હોટેલ	છાપરાનું બાંધકામ
૧૯	આશાપુરા સેલ્સ એજન્સી	છાપરાનું બાંધકામ
૨૦	ખોડીયાર ટી સ્ટોલ	છાપરાનું બાંધકામ
૨૧	એવન ઓપ્ટીકલ્સ-	છાપરાનું બાંધકામ
૨૨	પોપ્યુલર ફૂટવેર	છાપરાનું બાંધકામ
૨૩	વાઈબ્રન્ટ હેર સલુન	છાપરાનું બાંધકામ

ક્રમ	સ્થળ	દુર કરાવેલદબાણની વિગત
૨૪	ખોડલ મોબાઈલ એસસરીઝ	છાપરાનું બાંધકામ
૨૫	વિશાલ શુઝ	છાપરાનું બાંધકામ
૨૬	શિવાલય પાન	છાપરાનું બાંધકામ
૨૭	ડીલક્સ પાન	છાપરાનું બાંધકામ
૨૮	મોમાઈ ટી સ્ટોલ	છાપરાનું બાંધકામ

### (ટેક્સ શાખાની કામગીરી)

વન વીક વન રોડ અંતર્ગત વેરા વસુલ શાખા દ્વારા પેડક રોડ ખાતેથી ૬૨ આસામીઓ પાસેથી ૨૧ લાખ ૬૩ હજાર વેરાની વસુલાત કરવામાં આવેલ તેમજ વોર્ડ નં. ૫ માં ૦૨ અને વોર્ડ નં. ૬ માં ૦૬ મિલકતોને સીલ કરવામાં આવેલ.

### (ફુડ શાખાની કામગીરી)

- વન વીક વન રોડ અંતર્ગત FSSAI-2006 અન્વયે દૂધ તથા મીઠા માવા ના સર્વેલન્સ નમૂના ૪ લેવાયેલ.
- વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન ૦૭ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ. તેમજ ૦૭ કી.ગ્રાં. વાસી અખાદ્ય ખોરાક સ્થળ પર નાશ કરેલ.
- નમૂનાની કામગીરી -

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ સર્વેલન્સ નમૂના લેવામાં આવેલ :-

- (૧) મિક્સ દૂધ (લુઝ) સ્થળ- શ્રી રામ ડેરી ફાર્મ - પેડક રોડ
- (૨) મીઠો માવો (લુઝ) સ્થળ- પ્રભાત ડેરી ફાર્મ - પેડક રોડ
- (૩) મીઠો માવો (લુઝ) સ્થળ- રાઘેશ્યામ ડેરી ફાર્મ - પેડક રોડ
- (૪) મિક્સ દૂધ (લુઝ) સ્થળ- આશાપુરા ડેરી ફાર્મ - પેડક રોડ

- ખાણી-પીણી ના ધંધાર્થિઓની ચકાસણીની વિગત :-

ફૂડ વિભાગ દ્વારા તા. ૧૫/૦૧/૨૦૨૨ ના રોજ શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલ (૧) કીશવ ફૂડ ઝોન - વાસી રાઈસ , બ્રેડ , ચટણી-ગ્રેવી, બગડેલી ડુંગળી , બટેટા, ટામેટાં કુલ ૦૭ કી.ગ્રાં . સ્થળ પર નાશ. તથા હાયજીન બાબતે નોટિસ (૨) શ્રી રામ ડેરી ફાર્મ - લાયસન્સ બાબતે નોટીસ (૩) સત સાહેબજી ખમણ હાઉસ -લાયસન્સ બાબતે નોટીસ (૪) ભવાની ડેરી(શીતલ પાર્લર) - લાયસન્સ બાબતે નોટીસ (૫) યુવરાજ પાઉંભાજી - લાયસન્સ બાબતે નોટીસ (૬)આશાપુરા ડેરી ફાર્મ - લાયસન્સ બાબતે નોટીસ (૭) સંજીવની મેડિકલ સ્ટોર્સ - લાયસન્સ બાબતે નોટીસ આપેલ

તથા (૮) લાપીનોજ પિઝા (૯) પટેલ ડેરી એન્ડ આઈસક્રીમ (૧૦) સની પાજી દા ધાબા (૧૧) જીલ આઈસક્રીમ (૧૨) પ્રભાત ડેરી ફાર્મ (૧૩) રાઘેશ્યામ ડેરી ફાર્મ (૧૪) શ્રી હરિ મેડિકલ (૧૫) ઓમ ડિલક્ષ પાન (૧૬) નટરાજ એજન્સી (૧૭) સત્ય પ્રોવિજન સ્ટોર (૧૮) પારસ ફાર્મસી (૧૯) ગણેશ મદ્રાસ કાફે (૨૦) બજરંગ પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર (૨૧) સદગુરુ આઈસક્રીમ પાર્લર (૨૨) વિષ્ણુ ખમણ (૨૩ ) સીતારામ એન્ટરપ્રાઇસ (૨૪) પટેલ કેક શોપ (કેક એન જોય)ની સ્થળ પર ચકાસણી કરેલ.

### (સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી)

વન વીક વન રોડ અંતર્ગત પેડક રોડ પર જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ ૧૩ આસામીઓ પાસેથી રૂ. ૬,૦૦૦/-, કચરાપેટી ન્ રાખવા સબબ ૦૩ આસામીઓ પાસેથી ૧,૦૦૦/-નો વહીવટી ચાર્જ, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ ૧૦ આસામીઓ પાસેથી રૂ. ૬,૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ,

### (બાંધકામ/વોટરવર્કસ/ડ્રેનેજ શાખાની કામગીરી)

બાંધકામ/વોટરવર્કસ/ડ્રેનેજ શાખા ઇસ્ટ ઝોન વોર્ડ નં.૫ અને ૬ દ્વારા વન વીક , વન રોડ અંતર્ગત આજે તા.૧૫/૦૧/૨૦૨૨ના રોજ સ્ટ્રોમ વોટર મેનહોલ સફાઈ સંખ્યા - ૧૭, ડ્રેનેજ મેન હોલ સફાઈ સંખ્યા- ૧૬, પાણીની વાલ્વ ચેમ્બર સફાઈ સંખ્યા - ૦૯, ફૂટપાથ રીપેરીંગ (ચો.મી.) ૫૦, પેવીંગ બ્લોક રીપેરીંગ- (ચો.મી.) - ૭૦, રોડ રીપેરીંગ (ચો.મી.) - ૨૮, રબ્બીશ ઉપાડવાનુ કામ.(ધ.મી.) - ૧૨. વિગેરે કામગીરી કરવામા આવી હતી. હાલ કામગીરી ચાલી રહી છે.

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા